

Jos

Chapter 19

Gujarati Interlinear

Reference: American Standard Version

1
נְחֻלָּתָם וַיְהִי לְמִשְׁפַּחֹתָם שְׁמֵעוֹן בְּנֵי-לֵמָטָה לְשִׁמְעוֹן הַשֵּׁנִי הַגּוֹרָל הַנּוֹרָא וַיֵּצֵא
તેમનો-વારસો અને-હતો તેમના-કુળો-પ્રમાણે શિમ્યોનના પુત્રોના-ગોત્ર શિમ્યોનને બીજી યિઠ્ઠી અને-નીકલ્યો
[H5159](#) [H1961](#) [H4940](#) [H8095](#) [H4294](#) [H8095](#) [H8145](#) [H1486](#) [H3318](#)
בְּתוּרָה נַחֲלַת בְּנֵי-יְהוּדָה:
વચ્ચે વારસાની પુત્રોના-વારસાની
[H3063](#) [H5159](#) [H8432](#)

And the second lot came out for Simeon, even for the tribe of the children of Simeon according to their families: and their inheritance was in the midst of the inheritance of the children of Judah.

2
וַיְהִי לָהֶם לְנַחֲלָתָם בְּנַחֲלָתָם בְּאֶר-שֶׁבַע וּמוֹלָדָה:
તેમને-હતો તેમને તેમના-વારસામાં બેર-શેબા અને-શેબા અને-મોલાદાહ
[H4137](#) [H0884](#) [H5159](#) [H1992](#) [H1961](#)

And they had for their inheritance Beer-sheba, or Sheba, and Moladah,

3
שׁוּעַל-חֲזָרָה וּבָלָה וְעֶזֶם:
અને-હસાર-શૂઆલ અને-બાલાહ અને-એસેમ
[H6107](#) [H1088](#) [H2705](#)

and Hazar-shual, and Balah, and Ezem,

4
וְאֶלְתוֹלָד וּבְתוּלָה וְחֹרְמָה:
અને-એલ્તોલાદ અને-બથૂલ અને-હોર્માહ
[H2767](#) [H1329](#) [H0513](#)

and Eltolad, and Bethul, and Hormah,

5
וּזְכַלָּג וּבֵית-הַמַּרְכָּבוֹת וְחָזָר-סוּסָה:
અને-સિકલાગ અને-બેથ-હામ્મર્કાબોથ અને-હસાર-સૂસાહ
[H2701](#) [H1024](#) [H6860](#)

and Ziklag, and Beth-marcaboth, and Hazar-susah,

6
לְבָאֵתוֹבַיִת וְשָׂרુּהֵן עָרִים שְׁלֹשׁ עָרָה וְחַצְרֵיהֶן:
અને-બેથ-લબાઓથ અને-શારૂહેન નગરો ત્રે-એરાર અને-તેમનાં-ગામો
[H6240](#) [H7969](#) [H8287](#) [H1034](#)

and Beth-lebaoth, and Sharuhen; thirteen cities with their villages:

7
אֵין רִמְמוֹן וְעֶתֶר וְאַשָׁן עָרִים אַרְבַּע וְחַצְרֵיהֶן:
આયિન રિમ્મોન અને-એથેર અને-આશાન નગરો ચાર અને-તેમનાં-ગામો
[H0702](#) [H6228](#) [H6281](#) [H5871](#)

Ain, Rimmon, and Ether, and Ashan; four cities with their villages:

8
וְכָל-הַחֲצָרִים אֲשֶׁר סְבִיבוֹת הָעָרִים הָאֵלֶּה עַד-בְּאֶרְבַּעַת רָאמָת נֹגֵב זָאֵת
અને-બધાં-ગામો જે આસપાસ સ્બિબોત નગરોની આ આ-સુધી-બેર-બાલાથ-બેર રામાથ ન્ગબ આ
[H2063](#) [H5045](#) [H7414](#) [H1192](#) [H5704](#) [H0428](#) [H5439](#) [H3605](#)
נַחֲלַת מָטָה בְּנֵי-שְׁמֵעוֹן לְמִשְׁפַּחֹתָם:
વારસો ગોત્રનો પુત્રોના-શિમ્યોનના શિમ્યોનના-કુળો-પ્રમાણે
[H4940](#) [H8095](#) [H4294](#) [H5159](#)

and all the villages that were round about these cities to Baalath-beer, Ramah of the South. This is the inheritance of the tribe of the children of Simeon according to their families.

מְחֻבְּלֵי	בְּנֵי	יְהוּדָה	נַחֲלֹת	בְּנֵי	שִׁמְעוֹן	כִּי-	הָיָה	חֶלֶק	בְּנֵי-	יְהוּדָה	9
ભાગમાંથી	પુત્રોના	યહૂદાના	વારસો	પુત્રોની	શિમ્યોનની	કે-	હતી	ભાગ	પુત્રીની-	યહૂદાની	
		H3063	H5159	H8095	H1961					H3063	
רַב	מִמֶּנּוּ	וַיִּנְחֲלוּ	בְּנֵי-	שִׁמְעוֹן	בְּתוֹךְ	נַחֲלֹתָם:	פ				
ઘણો-વધારે	તેમના-માંટે	તેથી-મલ્યો	પુત્રોને-	શિમ્યોનના	વચ્ચે	તેમના-વારસાના	—				
	H1992	H5157		H8095	H8432	H5159					

Out of the part of the children of Judah was the inheritance of the children of Simeon; for the portion of the children of Judah was too much for them: therefore the children of Simeon had inheritance in the midst of their inheritance.

וַיֵּלֶעַל	הַגּוֹרָל	הַשְּׁלִישִׁי	לְבָנָי	זְבוּלֹן	לְמִשְׁפַּחְתָּם	וַיְהִי	גְבוּל	נַחֲלֹתָם	עַד-	10
અને-આવ્યો	ચિઠ્ઠી	ત્રીજો	પુત્રોને	ઝબુલૂનના	તેમના-કુળો-પ્રમાણે	અને-હતી	સીમા	તેમના-વારસાની	સુધી-	
H5927	H1486	H7992		H2074	H4940	H1961	H1366	H5159	H5704	
שָׂרִיד:										
સારીદ										
H8301										

And the third lot came up for the children of Zebulun according to their families. And the border of their inheritance was unto Sarid;

וְעַלָּה	גְבוּלָם	לְיִמִּי	וּמְרַעְלָה	וּפְנֵעַ	בְּרַבְשֶׁת	וּפְנֵעַ	אֶל-	הַגּוֹרָל	11
અને-ગઈ	તેમની-સીમા	પશ્ચિમ-તરફ	અને-મરાલાહ	અને-પહોંચી	દાબેશેથ-સુધી	અને-પહોંચી	-	નાના-સુધી	
H5927	H1366	H3220	H4831	H6293	H1708	H6293		H0413	
אֶשֶׁר	עַל-	בְּנֵי	יְקִנְעָם:						
જે	-	સામે	યોકનામની						
		H6440	H3362						

and their border went up westward, even to Maralah, and reached to Dabbesheth; and it reached to the brook that is before Jokneam;

וְשָׁב	מִשָּׂרִיד	קְדָמָה	מִזְרָח	הַשְּׁמֶשׁ	עַל-	גְבוּל	תְּבַרְכְּשֶׁת	וַיֵּצֵא	אֶל-	12
અને-વળી	સારીદથી	પૂર્વ-તરફ	ઉગતા	સૂર્યના	-	સીમા-સુધી	કિસ્લોથ-તાબોરની	અને-ગઈ	-	
H7725	H8301		H4217	H8121		H1366	H3696	H3318	H0413	
הַדְּבַרְת	וְעַלָּה	יְפִיעַ:								
દાબરાથ-તરફ	અને-ચઢી	યાફીઆ								
H1705	H5927	H3309								

and it turned from Sarid eastward toward the sunrise unto the border of Chisloth-tabor; and it went out to Daberath, and went up to Japhia;

וּמִשָּׁם	עָבַר	קְדָמָה	מִזְרָחָה	קַצְיֹן	קַצְיֹן	רִמּוֹן	הַמְּתָאָר	הַנֶּעֱמָה:	13
અને-ત્યાંથી	ગઈ	પૂર્વ-તરફ	પૂર્વ-દિશામાં	કાસીન-કાસીન	કાસીન-કાસીન	રિમ્મોન	વળીને	નેઆહ-સુધી	
H8033			H4217	H1662	H6278	H3318		H5269	

and from thence it passed along eastward to Gath-hepher, to Eth-kazin; and it went out at Rimmon which stretcheth unto Neah;

וַיֵּצֵא	אֶת	הַגְּבוּל	מִצְפּוֹן	תְּנָתָן	וְהָיוּ	תְּצַא	נָי	יְפִתַּח-אֵל:	14
અને-કરી	તેને	સીમા	ઉત્તરમાં	હન્નાથોન	અને-હતા	હન્નાથોન-હન્નાથોન	ખીણમાં	ચિક્તાહ-એલની	
H5437	H0853	H1366	H6828	H2615	H1961	H8444	H1516	H3317	

and the border turned about it on the north to Hannathon; and the goings out thereof were at the valley of Iphthah-el;

15 וְקַטְתָּ וְנַחְלָל וְשִׁמְרוֹן וַיִּדְאֵלָה לְחֶסְבֵית עָרִים שְׁתֵּים־עָשָׂר וְחֲצָרֵיהֶן: 15
 અને-કટાથ અને-નાહલાલ અને-શિમ્રોન અને-યિદાલાહ અને-બેથલેહમ નગરો શતીસ-બાર-અને-તેમનાં-ગામો
[H7005](#) [H5096](#) [H3030](#) [H1035](#) [H8147](#) [H6240](#)

and Kattath, and Nahalal, and Shimron, and Idalah, and Bethlehem: twelve cities with their villages.

16 זָאת נַחֲלַת בְּנֵי־זְבוּלֹן לְמִשְׁפַּחֹתָם הָעָרִים הָאֵלֶּה וְחֲצָרֵיהֶן: פ
 આ વારસો પુત્રોના-બુલૂન-ઝબુલોન લેમશ્પાહોતમ હેરોસ હા આ અને-તેમનાં-ગામો
[H2063](#) [H5159](#) [H2074](#) [H4940](#) [H0428](#)

This is the inheritance of the children of Zebulun according to their families, these cities with their villages.

17 לְיִשָּׁשְׁכָר יִצָּא הַגּוֹרָל הָרְבִיעִי לְבְנֵי יִשָּׁשְׁכָר לְמִשְׁפַּחֹתָם:
 ઇસ્સાખારને નીકલ્યો ગોરલ ચિઠ્ઠી ચોથી પુત્રોને લેમશ્પાહોતમ ઇસ્સાખારના
[H3485](#) [H3318](#) [H1486](#) [H7243](#) [H3485](#) [H4940](#)

The fourth lot came out for Issachar, even for the children of Issachar according to their families.

18 וַיְהִי אֲנֵי־טְרֵף וְגִבּוֹלָם יִזְרְעֵאלָה וְהַכְּסוּלֹת וְשׁוֹנָם:
 અને-હતી તેમની-સીમા તરફ-અલ-ચિઝરૂલ અને-કસુલોથ અને-શુનેમ
[H1961](#) [H1366](#) [H3157](#) [H3694](#) [H7766](#)

And their border was unto Jezreel, and Chesulloth, and Shunem,

19 וְחַפְרַיִם וְשִׁיּוֹן וְאַנְחָרַת:
 અને-હફારાયિમ અને-શિઓન અને-અનાહરાથ
[H2663](#) [H7866](#) [H0588](#)

and Hapharaim, and Shion, and Anaharath,

20 וְהַרְבִּית וְקִשְׁיוֹן וְאַבְעָן:
 અને-રબીથ અને-કિશ્યોન અને-એબેસ
[H7245](#) [H7191](#) [H0077](#)

and Rabbith, and Kishion, and Ebez,

21 וְרַמְתָּ וְעֵין־גַּנִּים חֲדָהוּעֵין פֶּזֶץ: וְבֵית
 અને-રેમેથ અને-એન-ગાન્નીમ અને-એન-હદાહ અને-બેથ-પાસ્સેસ
[H7432](#) [H5873](#) [H5876](#) [H1048](#)

and Remeth, and Engannim, and En-haddah, and Beth-pazzez,

22 וּפְנֵעַ הַגְּבוּל בְּתַבּוֹר (וְשַׁחְצוּמָה) (וְשַׁחְצוּמָה) וְהָיָה אֲנֵי־טְרֵף תְּשׁוּבָת וְהָיָה תְּצַאֲוֹת
 અને-પહોચી સીમા સુધી-તાબોર (અને-શાહસીમાહ) (અને-શાહસીમાહ) અને-બેથ-શેમેશ અને-હતા અને-હસી
[H6293](#) [H1366](#) [H8396](#) [H7831](#) [H7831](#) [H1053](#) [H1961](#) [H8444](#)

23 : וְחֲצָרֵיהֶן: עָרִים שְׁש־עָשָׂר וְחֲצָרֵיהֶן: גִּבּוֹלָם
 અને-તેમનાં-ગામો નગરો શત-સો અને-તેમની-સીમાના
[H1366](#) [H3383](#) [H8337](#) [H6240](#)

and the border reached to Tabor, and Shahazumah, and Beth-shemesh; and the goings out of their border were at the Jordan: sixteen cities with their villages.

23 : וְחֲצָרֵיהֶן: עָרִים שְׁש־עָשָׂר וְחֲצָרֵיהֶן: גִּבּוֹלָם
 અને-તેમનાં-ગામો નગરો તેમના-કુળો-પ્રમાણે ઇસ્સાખારના ઇસ્સાખારના પુત્રોના-ગોત્રનો વારસો આ
[H2063](#) [H5159](#) [H4294](#) [H3485](#) [H4940](#)

This is the inheritance of the tribe of the children of Issachar according to their families, the cities with their villages.

24 : וַיִּצָּא הַגּוֹרָל הַחֲמִישִׁי לְמַטֵּה בְּנֵי־אָשֶׁר לְמִשְׁפַּחֹתָם:
 અને-નીકલ્યો ચિઠ્ઠી પાંચમી ગોત્રને લેમશ્પાહોતમ આશરના પુત્રોના-આશરના
[H3318](#) [H1486](#) [H2549](#) [H4294](#) [H0836](#) [H4940](#)

And the fifth lot came out for the tribe of the children of Asher according to their families.

וַיְהִי	גְבוּלָם	חֶלְקָתָם	וַחֲלָי	וּבֵטֶן	וְאַחֲשָׁף:	25
અને-હતી	તેમની-સીમા	હેલકથ	અને-હલી	અને-બેટેન	અને-આકશાફ	
H1961	H1366	H2520	H2482	H0991	H0407	

And their border was Helkath, and Hali, and Beten, and Achshaph,

וְאֶלְמִלְחָה	וְעַמְעָד	וּמִשְׁאַל	וּפְנַע	בְּכַרְמֶל	הַיְמִינָה	לְבַנְתָּ: וּבְשִׁיחֹר	26
અને-અલ્લામ્લેખ	અને-અમાદ	અને-મિશ્આલ	અને-પહોચી	કાર્મલ-સુધી	પશ્ચિમ-તરફ	અને-શીહોર-લિબ્નાથ-સુધી	
H0487	H6008	H4861	H6293	H3760	H3220	H7884	

and Allammelech, and Amad, and Mishal; and it reached to Carmel westward, and to Shihor-libnath;

וְשֵׁב	מִזְרַח	הַשְּׁמֶשׁ	הַגְּזֵזְבִית	וּפְנַע	בְּזַבְלוֹן	וּבְנֵי	יִפְתָּח-אֵל	צְפוֹנָה	27
અને-વળી	ઉગતા	સૂર્ય-તરફ	બેથ-દાગોન	અને-પહોચી	ઝબુલૂન-સુધી	અને-ખીણમાં	યિફ્તાહ-એલના	ઉત્તર-તરફ	
H7725	H4217	H8121	H1016	H6293	H2074	H1516	H3317	H6828	
הָעֵמְקָבִית	וְנַעְיָאֵל	וַיֵּצֵא	אֶל-	כָּבוֹל	מִשְׁמָאֵל:				
બેથ-એમેક	અને-નઈએલ	અને-ગઈ	-	કાબૂલ-તરફ	સાબી-બાજુ				
H1025	H5272	H3318	H0413	H3521	H8040				

and it turned toward the sunrise to Beth-dagon, and reached to Zebulun, and to the valley of Iptah-el northward to Beth-emek and Neiel; and it went out to Cabul on the left hand,

וְעֵבְרוֹן	וְרַחֲב	וַחַמּוֹן	וְקַנָּה	עַד	צִידוֹן	רַבְּה:	28
અને-એબ્રોન	અને-રહોબ	અને-હામોન	અને-કાનાહ	સુધી	સીદોન	મહાન	
H5683	H7340	H2540	H7071	H5704	H6721		

and Ebron, and Rehob, and Hammon, and Kanah, even unto great Sidon;

וְשֵׁב	הַגְּבוּלָה	הַרְרָמָה	וְעַד-	עִיר	מִבְּצֻר-	צָר	וְשֵׁב	הַגְּבוּלָה	חֹהָה	וַיְהִיוּ	29
અને-વળી	સીમા	રામાહ-તરફ	અને-	નગર-સુધી	કિલ્લેબધ-	તૂરનું	અને-વળી	સીમા	હોસાહ	[અને-હતી]	
H7725	H1366	H7414	H5704	H4013	H6865	H4013	H7725	H1366	H2621	H1961	
(וְהָיוּ)	תְּצִאָתוֹ	הַיְמִינָה	מִחֻבְל	אַכְזִיבָה:							
(અને-હતી)	તેના-છેડા	સમુદ્ર-તરફ	બાગમાંથી	આકાબીબનો							
H1961	H8444	H3220	H0392								

and the border turned to Ramah, and to the fortified city of Tyre; and the border turned to Hosah; and the goings out thereof were at the sea by the region of Achzib;

וְעַמְמָה	וְאַפְק	וְרַחֲב	עָרִים	עָשָׂרִים	וַיִּשְׁתָּיֵם	וַחֲצִרְיָהוּן:	30
અને-ઉમ્માહ	અને-અફેક	અને-રહોબ	નગરો	બાવીસ	અને-બે	અને-તેમનાં-ગામો	
H5981	H0663	H7340		H6242	H8147		

Ummah also, and Aphek, and Rehob: twenty and two cities with their villages.

אֵאת	נַחֲלָת	מִטָּה	בְּנֵי-	אַשֶׁר	לְמִשְׁפַּחְתָּם	הָעָרִים	הָאֵלֶּה	וַחֲצִרְיָהוּן:	פ	31
આ	વારસો	ગોત્રનો	પુત્રોના-	આશેરના	તેમના-કુળો-પ્રમાણે	નગરો	આ	અને-તેમનાં-ગામો	—	
H2063	H5159	H4294	H0836	H4940	H0428					

This is the inheritance of the tribe of the children of Asher according to their families, these cities with their villages.

לְבָנֵי	נַפְתָּלִי	יֵצֵא	הַגְּזֵרָה	הַשְּׁשִׁי	לְבָנֵי	נַפְתָּלִי	לְמִשְׁפַּחְתָּם:	32
પુત્રોને	નફતાલીના	નીકવ્યો	ચિદ્દી	છદ્દી	પુત્રોને	નફતાલીના	તેમના-કુળો-પ્રમાણે	
H5321	H3318	H1486	H8345	H5321	H4940			

The sixth lot came out for the children of Naphtali, even for the children of Naphtali according to their families.

33 לַקּוּם - עַד- וַיְבַנְאוּ הַנֶּקֶב וְאָדָמִי בְצַעֲנַנִּים מֵאֵלֹן מִהֶלֶף גְּבוּלָם וַיְהִי 33
 લાક્કુમ સુધી- અને-યાબનએલ હાનેકેબ અને-અદામી સાનાનીમમાં એલોનથી હેલેફથી તેમની-સીમા અને-હતી
[H3946](#) [H5704](#) [H2995](#) [H5346](#) [H0129](#) [H6815](#) [H0438](#) [H2501](#) [H1366](#) [H1961](#)

וַיְהִי תֵצְאוּהוּ הַיַּרְדֵּן :
 અને-હતી તેના-છેડા અગત-અગત
[H3383](#) [H8444](#) [H1961](#)

And their border was from Heleph, from the oak in Zaanannim, and Adami-nekeb, and Jabneel, unto Lakkum; and the goings out thereof were at the Jordan;

34 מְנַב בְּבִלְוִן וּפְנֵעַ חוּקְקָה מִשֶּׁם וַיֵּצֵא תְבוּרָאזְנוֹת יָמֵהּ וְגְבוּלָם וַיָּשֶׁב 34
 દક્ષિણમાં બબુલુન-સુધી અને-પહોંચી હુક્કાક મ્શમ્થી અને-ઈઅ આઝનોથ-તાબોર પશ્ચિમ-તરફ સીમા અને-વળી
[H5045](#) [H2074](#) [H6293](#) [H8033](#) [H3318](#) [H0243](#) [H3220](#) [H1366](#) [H7725](#)

וּבְאֶשֶׁר מִיָּם פְּנֵעַ וּבְיָהוּדָה
 અને-આશર-સુધી પહોંચી અને-આગત
[H8121](#) [H4217](#) [H3383](#) [H3063](#) [H3220](#) [H6293](#) [H0836](#)

and the border turned westward to Aznoth-tabor, and went out from thence to Hukkuk; and it reached to Zebulun on the south, and reached to Asher on the west, and to Judah at the Jordan toward the sunrising.

35 וְכַנְרֶת רַקַּת וְחַמַּת זֶר מְבַצֵּר הַצְּדִים וְעָרָי 35
 અને-કિનેરેથ રક્કાથ અને-હામ્માથ સેર કિલ્લાનાં અને-કિલ્લેબંધ-નગરો
[H3672](#) [H7557](#) [H6863](#) [H6661](#) [H4013](#)

And the fortified cities were Ziddim, Zer, and Hammath, Rakkath, and Chinnereth,

36 וְאָדָמָה וְרָמָה וְחָצוֹר :
 અને-અદામાહ અને-હારામાહ અને-હાસોર
[H2674](#) [H7414](#) [H0128](#)

and Adamah, and Ramah, and Hazor,

37 וְקֶדֶשׁ וְאֶדְרַעִי וְחָצוֹר וְעֵינָן :
 અને-કેદેશ અને-એદ્રેઈ અને-એન-હાસોર
[H5877](#) [H0154](#) [H6943](#)

and Kedesh, and Edrei, and En-hazor,

38 עֶשְׂרָה - תְּשֻׁעַ- עָרִים שְׁמֹשׁבֵּית וּבֵית-עֲנַת חָרֵם וּמִגְדַּל-אֵל וַיְרָאוֹן 38
 - ઓગણીસ- નગરો અને-બેથ-શેમેશ અને-બેથ-અનાથ હોરેમ અને-મિગદાલ-એલ અને-થિરઓન
[H6240](#) [H8672](#) [H1053](#) [H1043](#) [H2765](#) [H4027](#) [H3375](#)

וְחָצְרֵיהֶן :
 અને-તેમનાં-ગામો

and Iron, and Migdal-el, Horem, and Beth-anath, and Beth-shemesh; nineteen cities with their villages.

39 פ - וְחָצְרֵיהֶן : הָעָרִים לְמִשְׁפַּחָתָם נַפְתָּלִי בְנֵי- מְטָה נַחֲלֹת אִזַּת 39
 - અને-તેમનાં-ગામો નગરો તેમના-કુળો-પ્રમાણે નફતાલીના પુત્રોના- ગીતનો વારસો આ
[H4940](#) [H5321](#) [H4294](#) [H5159](#) [H2063](#)

This is the inheritance of the tribe of the children of Naphtali according to their families, the cities with their villages.

40 הַשְּׁבִיעִי הַגּוֹרָל יֵצֵא לְמִשְׁפַּחָתָם דָּן בְּנֵי- לְמִטָּה 40
 સાતમી ચિહ્વી નીકલ્થો તેમના-કુળો-પ્રમાણે દાનના પુત્રોના- ગોત્રને
[H7637](#) [H1486](#) [H3318](#) [H4940](#) [H1835](#) [H4294](#)

The seventh lot came out for the tribe of the children of Dan according to their families.

41 וַיְהִי גְבוּל נַחֲלָתָם צָרְעָה וְאֶשְׁתָּאוֹל וְשִׁמְשׁ וְעִיר
 41 अन-इती सीमा वारसानी तेमना-वारसाणी सोरआइ
[H1366](#) [H1961](#) [H6881](#) [H5159](#) [H5905](#) [H0847](#)

And the border of their inheritance was Zorah, and Eshtaol, and Ir-shemesh,

42 וְשַׁעֲלָבִין וְאֵילָוִן וַיִּתְּלָהּ:
 42 अन-शांलाबबीन अन-आयालीन अन-यिथलाइ
[H8169](#) [H0357](#) [H3494](#)

and Shaalabbin, and Aijalon, and Ithlah,

43 וְאֵילֹן וְתִמְנָתָה וְעֶקְרוֹן:
 43 अन-अलीन अन-तिमनाथाइ अन-अक्रोन
[H0356](#) [H8553](#) [H6138](#)

and Elon, and Timnah, and Ekron,

44 וְאֶלְתֵּקָה וְגִבְתֹּן וּבְעֵלָת:
 44 अन-अलतकैइ अन-गिबथोन अन-बैलाथ
[H0514](#) [H1405](#) [H1191](#)

and Eltekeh, and Gibbethon, and Baalath,

45 וַיְהִי וּבְנֵי-בְרַק וְגַת-רִמּוֹן:
 45 अन-यहुइ अन-बने-बराक अन-ग-रिमोन
[H3055](#) [H1139](#) [H1667](#)

and Jehud, and Bene-berak, and Gath-rimmon,

46 הַיַּרְקוֹן וְיָמִי וְהַרְקוֹן עַם-הַגְּבוּל מוֹל יָפוֹ:
 46 अन-मे-हाय्यार्कोन अन-हारककोन साथे-सीमाना सामे याङ्गी
[H4313](#) [H7542](#) [H1366](#) [H4136](#) [H3305](#)

and Me-jarkon, and Rakkon, with the border over against Joppa.

47 וַיֵּצֵא גְבוּל-בְּנֵי-דָן וַיֵּצֵאוּ מִמָּהֶם וַיִּזְכְּרוּ עִם-לְשֵׁם
 47 अन-गयो प्रदेश-पुत्रो-दानो दाननो एन-गया अन-एलसा अन-वस्था
[H3318](#) [H1366](#) [H1835](#) [H1992](#) [H5927](#) [H1835](#) [H1835](#) [H3959](#) [H3427](#) [H0853](#) [H3423](#) [H2719](#) [H6310](#) [H0853](#) [H5221](#) [H0853](#) [H3920](#)

וַיִּלְכְּדוּ וַיִּשְׁבּוּ אֹתָהּ וַיִּשְׂרוּ אֹתָהּ וַיִּרְבּוּ לְפָנֶיהָ וַיִּקְרְאוּ לָלֶשֶׁם
 47 अन-कबल-कथुं अन-वस्था तेने अन-वारसामां-लीछुं धारे तलवारनी-तेने अन-माया तेने अन-माया तेने
[H3920](#) [H0853](#) [H3423](#) [H2719](#) [H6310](#) [H0853](#) [H5221](#) [H0853](#) [H3920](#)

וַיִּקְרְאוּ לָלֶשֶׁם וַיִּזְכְּרוּ אֶת-נַחֲלָתָם וַיִּזְכְּרוּ אֶת-נַחֲלָתָם וַיִּזְכְּרוּ אֶת-נַחֲלָתָם
 47 अन-नाम-पास्युं अन-नाम-पास्युं अन-नाम-पास्युं
[H7121](#) [H3959](#) [H1835](#) [H8034](#) [H1835](#) [H0001](#) [H1835](#)

And the border of the children of Dan went out beyond them; for the children of Dan went up and fought against Leshem, and took it, and smote it with the edge of the sword, and possessed it, and dwelt therein, and called Leshem, Dan, after the name of Dan their father.

48 וְזֵאת נַחֲלַת בְּנֵי-דָן מִטְּהָ גְבוּל-בְּנֵי-דָן וַיִּזְכְּרוּ אֶת-נַחֲלָתָם וַיִּזְכְּרוּ אֶת-נַחֲלָתָם וַיִּזְכְּרוּ אֶת-נַחֲלָתָם
 48 आ वारसो वारसो वारसो अन-नाम-पास्युं अन-नाम-पास्युं अन-नाम-पास्युं
[H2063](#) [H5159](#) [H4294](#) [H1835](#) [H4940](#) [H0428](#)

This is the inheritance of the tribe of the children of Dan according to their families, these cities with their villages.

